

અમેરિકા-જાપાનના 20 સ્ટુડન્ટ્સ 'ઈન્ડિયા કી ખોજ' પ્રોગ્રામમાં જોડાયાં

IIT-Gના પ્રોગ્રામના માધ્યમથી અનેક દ્રષ્ટિકોણથી ભારતને જાણશે

સિટી રિપોર્ટર  @ahm_cb

વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવવા આઈઆઈટી-ગાંધીનગર 2011થી 'ઈન્ડિયા કી ખોજ' કાર્યક્રમ યોજે છે. 10 દિવસના આ કાર્યક્રમમાં વિદેશી વિદ્યાર્થીઓ વક્તવ્યો, પ્રદર્શન, ગ્રૂપ ડિસ્ક્શન અને ફિલ્મ વિઝીટના માધ્યમથી ભારતને જાણે છે. આ વર્ષે અમેરિકાની કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 12 અને જાપાનની જાપાન એડવાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 8 વિદ્યાર્થીઓ 'ઈન્ડિયા કી ખોજ'માં ભાગ લેવા આવ્યા છે.

વિદેશી સ્ટુડન્ટ્સ આ રીતે જાણશે ભારત વિશે



- ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીઆશ્રમની મુલાકાત લઈને ગાંધીયન સુદર્શન આયંગર પાસેથી ગાંધીજીની નજરે ભારતને જાણશે
- જાણીતા સિતાર વાદક સૌહમ મુનિમ પર્ફોમન્સ આપશે અને ભારતીય સંગીતના વારસા અંગે જણાવશે
- મુવી સ્ક્રિનિંગ અને એક્સપર્ટ ટોકના માધ્યમથી ભારતીય સિનેમાની માહિતી મેળવશે